

૫. 'કિરણ' પાઘડી તરીકે રૂ. ૨૦૦૦૦ રોકડા લોપેશ જ પેઢીમાં રાખી મૂકવાના છે.
૬. 'કિરણ' તેના ભાગીની મૂડી તરીકે જૂના ભાગીદારોની હવાલાની અસર આપ્યા બાદની સંયુક્ત મૂડીની અડધી રકમ રોકડમાં લાવશે.

જરૂરી ખાતા તથા નવી પેઢીનું પાકુ સરવૈયું તૈયાર કરો.

- પ્ર.૨ અનુ, બીના અને ચિરાગ અનુક્રમે ૭:૫:૩ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચતા ભાગીદારો છે. તેઓની પેઢીનું તા. ૩૧-૩-૨૦૧૮ના રોજનું પાકુ સરવૈયું નીચે મુજબ હતું. (૧૫)

તા. ૩૧-૩-૨૦૧૮ના રોજનું પાકુ સરવૈયું

મૂડી-દેવાં	રકમ (રૂ.)	મિલકત-લેણાં	રકમ (રૂ.)
મૂડી:		જમીન-મકાન	૧૨૦૦૦૦
અનુ - ૧૫૦૦૦૦		ચંત્ર	૬૦૦૦૦
બીના - ૮૦૦૦૦		ફર્નિચર	૧૦૦૦૦
ચિરાગ - ૬૦૦૦૦	૨૯૦૦૦૦	સ્ટોક	૭૬૦૦૦
નફા-નુકશાન ખાતુ	૪૫૦૦૦	દેવાદારો	૭૦૦૦૦
સામાન્ય અનામત	૧૫૦૦૦	- ઘા. અનામત	૧૦૦૦
પરચુરણ લેણદારો	૪૦૦૦૦	હાથ પર રોકડ	૫૧૦૦૦
દેવી હૂંડી	૮૦૦૦		
પ્રોવિડન્ટ ફંડ	૧૮૦૦૦		
	૪૧૬૦૦૦		૪૧૬૦૦૦

તા. ૧ એપ્રિલ, ૨૦૧૮ના રોજ નીચેની શરતોએ 'ચિરાગ' નિવૃત્ત થયા.

૧. પેઢીની પાઘડી રૂ. ૭૫૦૦૦ આંકવામાં આવી અને જે ચોપડે દર્શાવવી.
૨. ફર્નિચર અને ચંત્રની કિંમત પર અનુક્રમે ૧૫% અને ૫% ઘસારો ગણો.
૩. જમીન મકાન અને સ્ટોકની કિંમતમાં અનુક્રમે ૨૦% અને રૂ. ૧૪૫૦૦નો વધારો કરવો.
૪. દેવાદારો પર ઘાલખાધ અનામત ૫% સુધી રાખવી.
૫. 'ચિરાગ'ને તેની લેણી નીકળતી રકમમાંથી રૂ. ૨૩૦૦૦ રોકડા ચૂકવવા અને બાકીની રકમ તેની લોન તરીકે પેઢીમાં રાખવી.

જરૂરી ખાતાઓ તથા 'ચિરાગ'ની નિવૃત્ત પછીનું પાકુ સરવૈયું તૈયાર કરો.

અથવા

- પ્ર.૨ (અ) નફા-નુકશાન હવાલાખાતુ નમૂના સહિત સમજાવો. (૦૮)
- (બ) ટૂંકનોંધ લખો (કોઈપણ બે): (૦૭)
૧. નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની થતી રકમ
 ૨. ભાગીદારના પ્રવેશ સમયે પાઘડીની આમનોંધો
 ૩. ભાગીદારની નિવૃત્તિ સમયે નવું નફા-નુકશાનનું પ્રમાણ.
 ૪. ભાગીદારના પ્રવેશ સમયે ભેગા થયેલ નફા કે નુકશાનની વહેંચણી.